



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૪/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૫ કેસ કરી, ૬૨ વ્યક્તિઓને ઝડપી, ૫૬૪ લીટર દેશી દારૂ, ૯૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ સ્કુટર અને ૧ ઓટોરિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૮,૭૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૨૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૨૮/૧૯

કાલુપુર : પ્રતિકભાઈ બાબુભાઈ શાહ (રહે.મલ્હાર બંગ્લોઝ, આનંદનગર ચાર રસ્તા પાસે, સેલ પેટ્રોલ પંપની સામે, વેજલપુર) એ તા.૦૮/૦૪/૧૯ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૩/૧૯ થી તા.૦૫/૦૪/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી પુનીત પ્રકાશભાઈ શાસ્ત્રી (રહે.શાંતીનગર, વિવેકાનંદ સ્કુલની પાસે, અમરાઈવાડી) એ પ્રતિકભાઈની “પુજા ઈલેક્ટ્રોનિક કંપની” નામની દુકાનમાં એકાઉન્ટ તરીકે નોકરી કરી, પ્રતિકભાઈને વિશ્વાસમા લઈ, તેમના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી, ચેક પોતાની પાસે રાખી લઈ, ચેક તથા આર.ટી.જી.એસ ફોર્મમાં ખોટી સહી કરી, ફોર્મનો ખોટો ઉપયોગ કરી, બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૭,૩૮,૦૦૦/- આર.ટી.જી.એસ મારફતે “એ યુસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક” જયપુર ખાતે ટ્રાન્સફર કરી, પ્રતિકભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.જી.દેસાઈ ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૬૨૯/૧૯

ખોખરા : શોભનાબહેન વા/ઓ રાજેન્દ્રકુમાર ઠાકર (ઉ.વ.૫૪)(રહે.બાજખેડાવાળ સોસાયટી ભદ્રપાર્કની બાજુમા અમદાવાદ મ્યુનીસીપલ મરાઠી શાળા) તા.૦૮/૦૪/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે અભીજન સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ સરનામુ પુછવાના બહાને શોભનાબહેન પાસે આવી તેમના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ શોભનાબહેન ઠાકરે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.પરમાર ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૬૩૦/૧૯

ઘાટલોડીયા : (૧) તેજસ શરદભાઈ દવે (રહે. નીર્મળ એપાર્ટમેન્ટ ૧૩૨ ફુટ રીંગ રોડ જયમંગલ બીઆરટીએસ સામે નારણપુરા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૪/૧૯ કલાક ૯/૦૦ થી તા.૦૮/૦૪/૧૯ કલાક ૩/૫૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા ૧૧,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૮૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.પટેલ ચલાવે છે.

ઘાટલોડીયા : (૨) ડૉ.પરીમીત પ્રદીપભાઈ નાયક (રહે, અર્જુન એલીગન્સ, ભગીરથ સોસાયટી, પટેલ કન્યા છત્રાલય સામે, ઘાટલોડીયા) એ તા.૮/૪/૧૯ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૩/૧૯ રાતના ૧૦/૦૦ થી તા.૨૩/૦૩/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ ડુપ્લીકેટ ચાવીથી ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૭૦,૯૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.મકવાણા ચલાવે છે.

વાડજ : જ્યોત્સનાબહેન વા/ઓ કિશનભાઈ ખટીક (રહે ભુરાભાઈ ની છેલ્લી ચાલી રબારી વસાહત રામાપીરનો ટેકરો નવા વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૪/૨૦૧૯ સાંજના ૪/૦૦ થી તા.૦૮/૦૪/૨૦૧૯ ના કલાક ૭/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૬,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.મીશ્રા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૩૧/૧૯

રામોલ : જ્યોત્સનાબહેન વા/ઓ સુનીલભાઈ શ્રીવાસ (ઉ.વ.૨૮)(રહે.સાંઇધામ સોસાયટી, રૂઢ કોમ્પલેક્ષની બાજુમા મહાદેવનગર વસ્ત્રાલ) એ અગમ્ય કારણસર તા.૮/૪/૧૯ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ઓ.ભરવાડ ચલાવે છે.

નિકોલ : દિપકભાઈ પુંજાભાઈ પરમાર (ઉ.વ.૩૫)(રહે.વણકરવાસ જોગણી માતાના મંદિર પાસે નિકોલ ગામ નિકોલ) એ અગમ્ય કારણસર તા.૮/૪/૧૯ કલાક ૯/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે લોખંડની ઓંગલ સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કિરણભાઈ નારણભાઈ ચલાવે છે.

દાણીલીમડા : રસ્મિકાબહેન ડો/ઓ બાલાભાઈ મકવાણા (ઉ.વ.૨૬)(રહે.દાઉદની ચાલી કેલિકો ક્વાર્ટર્સ પાસે દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૮/૪/૧૯ કલાક ૧૨/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.કુરેશી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.